

જુલાઈ 18, 2018

આપણાં શહેરને ઓપન ડેટા પ્લેટફોર્મ માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળે છે
Esri (એસરી) 2018 GIS માં ખાસ ઉપલબ્ધિ એવોર્ડ બ્રામ્પટન જીયોહબને એક ઓળખ આપે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો: સીટી ઓફ બ્રામ્પટનને તેના નવીન ઓપન ડેટા પ્લેટફોર્મ, બ્રામ્પટન જીયોહબ માટે ફરી એકવાર ઓળખ મળી. એસરી ઈન્કો., જ્યોગ્રોફિકલ ઈન્ફર્મેશન સર્વિસીસ (GIS) માં એક વૈશ્વિક આગેવાને આપણાં શહેરને GIS સોફ્ટવેરની ધરમૂળથી ફેરફાર કરતી અને પરિવર્તન કરવાની શક્યતાઓ દેખાડવા બદલ 2018 એસરી GIS (SAG) માં ખાસ ઉપલબ્ધિ એવોર્ડ આપવામાં આવ્યો.

બે કેનેડિયન એવોર્ડ-વિજેતાઓ પૈકી એક તરીકે, આપણાં શહેરની પસંદગી વધારે સારી સેવાઓ પહોંચાડવા GIS ટેકનોલોજીના અસરકારક એન્ટરપ્રાઇઝ અમલીકરણ માટે 300,000 ઉપરાંત પાત્રતા ધરાવતા ઉમેદવારોમાંથી કરવામાં આવી.

બ્રામ્પટન જીયોહબ (GeoHub), એક ઓપન ડેટા પ્લેટફોર્મ અને સહયોગી ટેકનોલોજી છે જે લોકો માટે જાહેર માહિતી સુધી પહોંચ મેળવવાનું વધારે સરળ બનાવે છે. તે [મેપ્સ \(નક્શાઓ\)](#), [એપ્સ \(એપ્લિકેશન્સ\)](#), [સ્ટોરીસ](#) અને [ડેટાસેટ્સ](#)નું ઘર છે જે શહેરમાં થઈ રહેલી બાબતોની ઝાંખી કરાવે છે, જેમ કે:

- **શહેરનું ડેશબોર્ડ:** શહેરની મ્યુનિસિપલ સર્વિસ કામગીરી અને સામુદાયિક પગલાઓની દેખરેખ રાખવી.
- **બ્રામ્પટન 2040 દૂરદેશીપણુંનો સારાંશ:** આ શહેરે તમામ ઉંમર, પશ્ચાદભૂ અને અનુભવો ધરાવતા લોકોને બ્રામ્પટનના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના પાસાદાર મૌલિક વિચારો વહેંચવા કહ્યું. પરિણામો વિશે વધુ માહિતી અહીં જાણો.
- **પાર્ક્સ અને રિક્રિએશન્સ લોકેટર:** શું બ્રામ્પટનમાં નવા છો, અથવા તમે અગાઉ મુલાકાત ન લીધી હોય તેવી સુવિધાઓ શોધી રહ્યા છો? રહેવાસીઓ પોતાના પાડોશમાં ઉપલબ્ધ ઉદ્યાનો, શાળાઓ અને મનોરંજનની સગવડો અહીં શોધી શકે છે.
- **રોડ વર્ક્સ વ્યુઅર:** બ્રામ્પટનમાં બાંધકામ પ્રોજેક્ટ્સ અને બંધ રસ્તાઓ જુઓ જેથી તમે શહેરમાં અવરજવરનું આયોજન કરવા અને ટ્રાફિક ભીડમાંથી મુક્તિ માટે મદદ મેળવી શકો.

એસરી એક વૈશ્વિક કંપની છે જે ધંધાઓ, સરકારો અને શૈક્ષણિક સંસ્થાઓને સક્ષમ બનાવતા વિશ્વ-કક્ષાના એવા એન્ટરપ્રાઇઝ GIS ઉકેલો પૂરા પાડે છે જેથી ભૂગોળના પ્રભાવનો લાભ અપાવીને સમયસર, માહિતગાર અને લક્ષ્ય-સટીક નિર્ણયો લઈ શકાય. SAG એવોર્ડ્સનો અર્થ એવી સંસ્થાઓ માટે કદર દેખાડવાનો છે જે દુનિયાના સૌથી કપરા કેટલાક પડકારો ઉકેલવા GIS નો ઉપયોગ કરતી હોય.

આ પહેલી વખત નથી કે આ શહેરને ઓપન ડેટામાં તેના પ્રયત્નો માટે, વધારે મોટા પાયે વિચારવા અવિરત કટિબદ્ધતા દર્શાવવા બદલ ઓળખ મળી હોય. સુધારેલા ટ્રિવ-માર્ગીય ડેટા વહેંચણી અને સંચાર સક્ષમ બનાવતા સાધન તરીકે, જીયોહબ પારદર્શકતા વધારવાનું અને નવીન શોધને પોષવાનું, અને રહેવાસીઓને પોતાના સમુદાય અને તેની આસપાસની વધારે સારી સમજ કેળવવા દેવાનું ચાલુ રાખે છે.

બ્રામ્પટન જીયોહબ વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, <http://geohub.brampton.ca>

અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રામ્પટન એ સાબિત કરવાનું ચાલુ રાખ્યું છે કે આપણે ઉત્કૃષ્ટતા અને નવીન શોધની આગેવાની કરીએ છીએ, અને એ કે આપણે ટેકનોલોજીમાં એક વૈશ્વિક આગેવાન બનવાના માર્ગ પર છીએ. બ્રામ્પટન જીયોહબ માટે છેલ્લામાં છેલ્લો એવોર્ડ જીતવા બદલ આપણો

કર્મચારીગણને અભિનંદન, અને આ શહેર ભવિષ્ય માટે તૈયાર, સ્માર્ટ સીટી બનવા જે મહેનતું કામ બ્રામ્પટન રહેવાસીઓ વતી કરી રહ્યું છે તેને એક અન્ય ઓળખ મળી છે.

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“કર્મચારીગણનો સમય અને તેથી કરદાતાના મૂલ્યવાન નાણાં બચાવવાની સાથે સાથે, અને તેથી જાહેર માહિતી સુધી પહોંચ મેળવવા અને તેનો ઉપયોગ કરવા તમામ રહેવાસીઓ માટે વધારે સરળ બનાવવા, જીયોલબે ઉત્તરોત્તર નવીન બ્રામ્પટન માટેનો માર્ગ તૈયાર કરવાનું ચાલુ રાખ્યું છે. ઓપન ડેટા ટીમને બીજી એક ચડિયાતી ઉપલબ્ધિ બદલ અભિનંદન.”

- કાઉન્સિલર ગેલ માર્મિલ્સ (Gael Miles), કોર્પોરેટ સર્વિસીસ ચેર

“સીટી ઓફ બ્રામ્પટન ભવિષ્ય માટે તૈયાર શહેર બનવા અને ઉત્તમ સરકારી સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. અમારી GIS અને ઓપન ડેટા ટીમ આ દૂરદેશીપણું માટે અનિવાર્ય છે, અને તેઓ જીયોલબ સાથે કરી રહ્યાં છે તે પરિવર્તનલક્ષી કામ મારફતે અમે નવીન શોધને પોષવાનું ચાલુ રાખ્યું છે. અમને આ પદવી બદલ એસરી દ્વારા ઓળખ મળવા બદલ અમે કૃતજ્ઞ છીએ.”

- જોસેફ પિટ્ટારી (Joseph Pittari), કમિશ્નર ઓફ કોર્પોરેટ સર્વિસીસ

ઝડપી કડીઓ

- [સીટી ઓફ બ્રામ્પટન કર્મચારી ઓપન સીટી ચેમ્પિયનનો એવોર્ડ જીતે છે](#)
- [શહેરને બ્રામ્પટન જીયોલબ માટે એસરી કેનેડાનો એવોર્ડ ઓફ એક્સીલન્સ મળે છે](#)
- [સીટી ઓફ બ્રામ્પટન ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં પ્રગતિ માટે બે એવોર્ડ જીતે છે](#)

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.